

ઈ-મેઇલ મેસેજ

પ્રતિ :- ડાયરેક્ટરશ્રી, ગુજરાત ઇન્ફોર્મેટીક્સ લી., ગાંધીનગર (gujinfo.gog@gmail.com)

જાણ :- (૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા., ગાંધીનગર
(૨) અધિક પોલીસ મહાનિદેશક અને કમિશ્નરશ્રી તકનીકી સેવા, ગુ.રા., ગાંધીનગર

(gswan-conn@gujarat.gov.in)

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, જૂનાગઢ વિભાગ, જૂનાગઢ

પ્રેષક :- પોલીસ અધિક્ષક, પોરબંદર.

નંબર :- કોમ્પ્યુટર/વેબસાઇટ અપલોડ/૨૦૨/૨૦૨૨, તા.૧૧/૦૪/૨૦૨૨

વિગત :-

સવિનય આપશ્રીની કચેરીના જીસ્વાન મેસેજ નં. જી૧(કાઇમ)/ટે-૨/સારી કામગીરી/૧૭૮૧/૨૦૧૨, તા.૧૭/૦૫/૨૦૧૨ તથા ગૃહ વિભાગ ગાંધીનગરના નં. આઇટી/ ૧૦૨૦૧૧/૩૦/આઇટી સેલ/૨૦૧૨ તા.૧૨/૦૭/૨૦૧૨ અન્વયે પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૦૪/૦૪/૨૦૨૨ થી તા.૧૦/૦૪/૨૦૨૨ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય :-

(૧) હાર્બર મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૮૦૧૮૨૨૦૧૦૪/૨૦૨૨ IPC ક.૩૮૦,૪૫૪,૪૫૭,૧૧૪ મુજબના કામે કોઇ અજાણ્યા ઇસમે ફરીયાદીની “વિરાટ ” નામની તથા સાહેદોની ફિશીંગ બોટોમાં પ્રવેશ કરી બોટના એન્જીનની કુલીંગ ટાંકીના સેલ જે એકની કિ.રૂ.૧૦,૦૦૦/- એમ કુલ સેલ નંગ૧૮ કિ.રૂ.૧,૮૦,૦૦૦/- ની કોઇ ઇસમે ચોરી કરી લઇ ગયેલ હોય આ કામની તપાસ દરમ્યાન સાહેદોના નિવેદનો તથા ”નેટ્રમ” કંપાન કંટ્રોમાં CCTV કેમેરા ચેક કરતા શંકાસ્પદ ઇકોવાન જોવામાં આવેલ. જે આધારે ઇકો વાન માલિકની પુછપરછ/તપાસ કરતા સદર ગુન્હાના આરોપીઓ તરીકે (૧) ભાવેશ મનસુખભાઈ સોલંકી (૨) સંજય ભરત રાજગર (૩) મહેશ કરશન સોલંકી (૪) રહીશ યુનુસભાઈ સોરઠીયાના નામ ખુલવા પામેલ હોય. જેથી તેઓને શોધી પુછ-પરછ કરતા ગુન્હો કર્યા નો એકરાર કરતા હોય. જેથી અનુ નં.(૧) થી (૩) ને તા.૦૬/૦૪/૨૦૨૨ તથા અનુ નં.(૪) ને તા.૦૮/૦૪/૨૦૨૨ના રોજ અટક કરવામાં આવેલ છે અને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કિ.રૂ.૧,૮૦,૦૦૦/- રીકવર કરવામાં આવેલ. હાલ અન્ય ત્રણ આરોપીઓ જેમા (૧) વીપુલ નાથા મકવાણા (૨) રમેશ ઇગન સોલંકી (૩) સાગર જેન્તી મકવાણા નાસતા ફરતા છે. જે અંગે હાલ તપાસ ચાલુ છે.

મુદ્દા નંબર ૫:- વૃધ્ધો મહીલાઓ કે બાળકોની સુરક્ષા માટેની વિશિષ્ટ કામગીરી :-

(૧) તા.૦૪/૦૪/૨૦૨૨ થી તા.૧૦/૦૪/૨૦૨૨ દરમ્યાન હાર્બર મરીન પો.સ્ટે.ના સી ટીમના કર્મચારીઓ દ્વારા કુછડી અને સુભાષનગર વિસ્તારમાં મોડી રાત્રીનાં મજૂરી પર થી ઘરે જતી મહીલાઓને સી-ટીમ તથા ડાયલ ૧૦૦ નંબર, ૧૮૧ વિશે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ અને કોઈ તકલીફ કે મુશ્કેલી હોય તો સી-ટીમ તથા ડાયલ ૧૦૦ નંબર પર જાણ કરવા સમજ કરેલ. તેમજ ઓડર અને સુભાષનગર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી સીનીયર સિટીઝનની મુલાકાત લેવામાં આવેલ.

મુદ્દા નંબર ૬:- અન્ય લોકહીતની બાબતો જે લોકોને તુરંત જ ધ્યાન પર આવે તેવી બાબતો :-

(૧) ૦૪/૦૪/૨૦૨૨ થી તા.૧૦/૦૪/૨૦૨૨ સુધી હાર્બર મરીન પો.સ્ટે.ના કર્મચારીઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ૩૮ માસ્કનું વિતરણ કરી માસ્ક પહેરવા તથા જરૂરી તકેદારી રાખવા સમજ કરેલ.

જે આપશ્રીને વિદિત થાય.

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર eGujcop

પોરબંદર